

21st March 2024

To,

Department of Corporate Services

BSE Limited,

P. J. Towers, Dalal Street,

Mumbai - 400 001

Security Code: 542460

Security ID: ANUP

Symbol: ANUP

Listing Department

National Stock Exchange of India Limited,

Exchange Plaza, 5th Floor Plot No. C/1,

G. Block Bandra - Kurla Complex, Bandra (E), Mumbai - 400 051

To,

Dear Sir/Madam,

Sub.: Disclosure under Regulations 30 and 47 of Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("SEBI Listing Regulations") – Newspaper Advertisement

Pursuant to Regulation 47 read with regulation 30 and other applicable provisions of SEBI Listing Regulations please find enclosed a copies of Newspaper Advertisement published on 21st March 2024 in The Financial Express (In English – All India Edition and in Gujarati – Ahmedabad Edition) regarding the Notice of Extra-Ordinary General Meeting ("EOGM") of the Company is scheduled to be held on Friday, 12th April 2024 at 11:00 A.M. (IST) through Video Conferencing (VC)/Other Audio Visual Means (OAVM).

The above information is made available on the website of the Company i.e. https://www.anupengg.com/notices-given-to-shareholders-by-advertisement/.

Kindly take the same on your record.

Thanking you,

Yours faithfully,
For, The Anup Engineering Limited

Chintankumar Patel
Company Secretary
Membership No.: A29326

Encl.: as above

E: anup@anupengg.com

• QUICK COMMERCE SPACE GETTING CROWDED

Profits won't come so quick

AYANTI BERA March 20

DEEPINDER GOYAL BELIEVES his quick commerce business, Blinkit, could become bigger than Zomato in a year. Given the quick commerce space is tipped to grow at 30-35% annually, this is not surprising. The market could be worth ₹1.5 trillion a year —about 25 million households that spend an average of ₹4,000-5,000 a month to have goods and goodies delivered home within 10-30 minutes. It would explains Goyal's conviction on Blinkit's prospects. It would also explain why Flipkart has decided it wants to be part of the space once again.


Today, qucik commerce services reach some 25 cities and experts say this could double in the next five years. But the large market isn't the only reason why Goyal is so keen on the space or why Flipkart is looking to make a comeback. It's because this is not a winner-takes-it-all kind of market—there's room for three or four players to do well.

As Sachin Salgaonkar and Shalav Saket, who analyse the sector at Bank of America, point out, no one player would be able walk away with the lion's share. "The market share between the players would gravitate towards 35%, 30% and 25% for the top three and may not see a disproportionate 50-60% plus share for one player," they opine. As Ravi Kapoor, Partner and Leader — Retail & Consumer PwC, says, at an annual \$3 billion, the quick commerce market is yet to mature. Also, Kapoor believes that the AoV (average order value), density and frequency are equally important to deliver profits and the reason it's hard for one player to corner a disproportionate share.

This would explain Flipkart's confidence in re-entering a market where Blinkit is the market leader, Swiggy's Instamart is making significant headway and where Zepto is moving fast. Blinkit's run rate of six lakh orders a day, as per industry sources, is ahead of Swiggy Insta-Mart's five lakh order and Zepto's daily volumes of 0.3 million.

Also, BigBasket is making changes to its model; it has revamped its slotted delivery service to 'supersaver' in 40 cities, to fulfill orders in less than b n⊙w blinki

BLINKIT'S LEADING THE WAY



2 hours and offer an additional 5% in savings. It has also moved to a bikebased service. Experts believe JioMart could be a key contender.

QUICK COMMERCE

IS NOT A WINNER-

TAKES-IT-ALL KIND

FOUR PLAYERS TO

OF MARKET—

THERE'S ROOM

FOR THREE OR

DO WELL

Dunzo, which reported losses of ₹1,800 crore in FY23, however, seems to have lost its way.

Flipkart's advantage is that it is firmly entrenched in the e-commerce space and, with its wide assortment, can score over incumbents. At the same time, it would need to add

some categories of daily use since groceries and FMCG account for an estimated 75 % of the GMV (gross merchandise value) for Q-commerce platforms.

Source: BofA Global Research

Experts say, however, the QCommerce space calls for a different set of execution skills and that platforms need to work in a certain way to move to positive unit economics.

According to Puneet Mansukhani, Partner- Digital Advisory& Retail Head, KPMG, it's critical to get the unit economics right quickly. "Since grocery is typically not a profitable business, the model is hard to crack," he says. Adds an industry insider "Running dark stores for QCommerce is an altogether different proposition because they need to become profitable quickly".

Of course, Flipkart has the advantage of being able to cross-sell to its existing customer base. And having run an e-commerce operation for many years, it would be up-to-speed on the data analytics.

As Mansukhani says, how platforms use data to gauge customer preferences is important to decide which categories to offer. "Product needs can change within a 10km distance. A Golf Course Road customer would be very different from a Sona Road customer so inventories in the dark stores will need to match the varying preferences," he explains. Adds PWC's Kapoor, "This is a very complex model with the result that one player can be strong is one micro market, say a Powai, but perhaps not in another like South Bombay".

Flipkart faces keen competition. Blinkit is the market leader and proved it has the DNA to run a OCommerce operation. Both Instamart and Blinkit can leverage their existing customer bases to cross-sell a range of products.

Zepto, say industry insiders, is becoming aggressive as seen in its delivery charges that are now the lowest in most places. Blinkit has made a name for itself in the kitchen, cooking essentials, home & personal care categories while Zepto is gaining goodwill in the fresh fruit and vegetables segment.

Meanwhile, Swiggy's Instamart is getting good traction in the indulgence category while Big Basket's wide assortment, including store labels, is a hit. BigBasket has recently revamped its slotted delivery service to 'supersaver' in 40 cities, to be able to fulfill orders in less than 2 hours and offer an additional 5% savings on a range of products. To be able to break into this market Flipkart will need to have a USP, first to attract customers and then to retain them.

The completion means the road to profitability is a long one. The trick, as Kapoor sees it would be to ramp up volumes, in something of a flywheel effect and benefit from economies of scale. "Brands will want to work with these platforms," he says. Mansukhani believes players are beginning to take corrective action. "They have started levying a convenience fee and some are charging a subscription fee so that customers are sticky. Else it will be difficult to cut the losses," he says. With Flipkart in the fray, that will now be harder.

AI makes debut in LS polls with 'new' videos of voice cloning

SOUMYARENDRA BARIK New Delhi, March 20

■ A conference organised by a wing of Tamil Nadu's ruling DMKin January 2024 had a surprising guest appearance: M Karunanidhi appeared on a big screen in his trademark black sunglasses, white shirt and a yellow shawl, praising the leadership of his son and Tamil Nadu CM MK Stalin. Except, Karunanidhi died in 2018.

■In February 2024, the official handle of the AIADMK shared a voice message by party stalwart J Jayalalithaa in which she urges

people to support its current leader Edappadi Palaniswami. Jayalalithaa died in 2016.

■ The Congress's official Instagram handle shared a deepfake where Prime

Minister Narendra Modi's face was superimposed onto that of Justh, the singer of a popular song titled Chor (thief). The vocals and lyrics of the song were altered through AI to make it sound like it was Modi's voice. ■ The BJP shared on Insta-

gram a deepfake of Rahul Gandhi to make it seem that the Congress leaderwas uttering the words: "I don't do anything."

As the battleground for the Lok Sabha polls heats up, political parties find a new weapon in their arsenal: sharing content on social media platforms such as Facebook, Instagram, YouTube and X that are generated through artificial intelligence (AI) to either promote their own candidates or ridicule opponents and send targeted personalised messages to voters.

With the world's most populous country heading towards the biggest election process in the democratic world in 2024, all eyes are on India, where experts believe AI will be used on an unprecedented scale - and potentially be a deciding factor like social media was in the 2014 polls – even as the impact of the disruptive technology on voters remains to be seen.

Since the beginning of this year, both the BJP and Congress have shared content altered through AI on at least four occasions on their official Instagram handles. The themes of these

> manipulated media - called deepfakes in common parlance are similar: project leaders of the other party in a bad light.

Most recently, on Instagram, the Congress shared a picture of PM

Modifacingaposterofawoman wrestler in tears. Ahead of the Assembly elections in Telangana last year, the official X handle of the Telangana Congress shared a deepfake of BRS leader KT Rama Rao purportedly urging the public to vote against his party.

The BJP has released at least two manipulated videos in the last few months - besides the Rahul Gandhi "I don't do anything"deepfake, another where AI was used to recreate voices of Opposition leaders Mamata Banerjee, Arvind Kejriwal and Akhilesh Yadav, among others.

Voice clones of candidates, generated by AI, are expected to be used by political parties for targeted messaging to voters, preferably days before the votes are cast.

Remove all unauthorised political ads: **EC** to Centre and states

PRESS TRUST OF INDIA New Delhi, March 20

CRACKING THE WHIP, the Election Commission on Wednesday asked state governments to take down all unauthorised political advertisements from government, public and private properties and send a compliance report in the next 24 hours.

In a letter to the Union Cabinet secretary and the chief secretaries of all states and UTs, the EC said despite its letter issued on March 16 when the model code of conduct for the Lok Sabha elections and four assembly polls came into force, it has received complaints alleging that unauthorised political advertisements are still being displayed in many places across the country.

The Congress had recently raised the issue with the poll panel."All unauthorised political advertisements, in the form of wall writings, posters, papers or defacement in any other form, cutouts, hoardings, banner flags were ordered to be removed in a time-bound manner from public spaces like railway stations, bus stands, airports, railway bridges, roadways, government buses, electric/telephone poles, municipal/local bodies' building and a strict compliance in this was to be ensured," it said.

The EC said it has taken a "serious note" of the non-compliance or partial-compliance of its instructions. It directed all state and UT governments to "immediately remove all unauthorised political advertisements and ensure full compliance of its instructions".

RailTel (A Govt. of India undertaking) (CIN: U64202DL2000G0I107905) GeM Bid Nos. GEM/2024/B/4796229, 4797159, 4797647, 4797797, 4798073, 4798194 & 4798298, Dt. 19.03.2024 RailTel/ER invites e-bids from eligible bidders for the

work of "Deployment of maintenance team for maintenance of optic fibre cable network and upkeep of

associated gears in 07 (seven) Sections of RCIL/ER for a period of 2 years and extendable by one year on same Detailed GeM Bid Notice/ GeM Bid Document available on https://www.railtel.in, https:// eprocure.gov.in and https://gem.gov.in. All future Addendum/ Corrigendum etc. will be uploaded of RailTel website. CPP Portal and GeM Portal. Bidders have to submit their bids on GeM Portal only.

Place: Ahmedabad

Date: 20th March 2024

TATA TATA POWER

(Corporate Contracts Department) Sahar Receiving Station, Near Hotel Leela, Andheri (E), Mumbai 400 059, Maharashtra, India (Board Line: 022-67173188) CIN: L28920MH1919PLC00056

NOTICE INVITING EXPRESSION OF INTEREST The Tata Power Company Limited hereby invites Expression of Interest from eligible parties for

Comprehensive Annual Maintenance Contract for various type of Air Conditioners across Mumbai for a period of two years (Ref No: CC23FK137). For details of pre-qualification requirements, purchasing of tender document, bid security, etc., pleas

isit Tender section of our website (URL: https://www.tatapower.com/tender/tenderlist.aspx) Eligible parties willing to participate may submit their expression of interest along with the tender for on or before 27" March 2024.

TATA TATA POWER

(Corporate Contracts Department) Tata Power Trombay Thermal Power Station, Corporate Contracts, 5t Floor, Station B, The Tata Power Company Limited, Chembur-Mahul Mumbai 400074 13, Maharashtra, India.

(Board Line: 022-67175923, Mobile 9223501476) CIN: L28920MH1919PLC000567 NOTICE INVITING EXPRESSION OF INTEREST The Tata Power Company Limited hereby invites Expression of Interest from interested and

eligible parties for following job at Tata Power Trombay Thermal Power Station, Distt Mumbai,

Renovation and modification job for PSP boardroom at Trombay civil office at For details of pre-qualification requirements, purchasing of tender document, bid

security, etc., please visit Tender section of our website (URL: https://www.tatapower.com/tender/tenderlist.aspx). Eligible parties willing to participate may submit their expression of interest the above job along with the tender fees for issue of espective tender documents latest by 7° April 2024.

2 Anup

THE ANUP ENGINEERING LIMITED

CIN: L29306GJ2017PLC099085

Regd. Office: Behind 66 KV Elec. Sub-Station, Odhav Road, Ahmedabad-382415 Tel. No.: +91-79-4025 8900 Fax No.: +91-79-2287 0642 Email: investorconnect@anupengg.com Website: www.anupengg.com

NOTICE OF THE EXTRA ORDINARY GENERAL MEETING OF THE COMPANY

Notice is hereby given that the Extra-Ordinary General Meeting ("the EGM / the meeting") of the Members of M/s. The Anup Engineering Limited ("the Company") will be held on Friday, 12th April, 2024 at 11:00 a.m. (IST) through Video Conference ("VC") / Other Audio-Visual Means ("OAVM") to transact the business(es) set forth in the Notice of EGM dated 20th March 2024

Pursuant to General Circular No. 14/ 2020 dated 8th April 2020 read with other relevant circulars including 09/2023 dated 25th September 2023 issued by the Ministry of Corporate Affairs ('MCA') (collectively referred to as "MCA Circulars") and Securities and Exchange Board of India ("SEBI") vide its circular no. SEBI/HO/CFD/ CMD1/CIR/P/2020/79 dated May 12, 2020, circular no. SEBI/HO/CFD/ CMD2/CIR/P/2021/11 dated January 15, 2021, circular no. SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62 dated May 13, 2022, circular no. SEBI/HO/CFD/PoD- 2/P/CIR/2023/4 dated January 5, 2023 and circular no. SEBI/HO/CFD/CFD-PoD-2/P/CIR/2023/167 dated October 07, 2023 (collectively "SEBI Circulars"), have permitted companies to conduct EGM through VC or other audio visual means, subject to compliance of various conditions mentioned therein. In compliance with the aforesaid MCA Circulars and SEBI Circulars and the applicable provisions of Companies Act, 2013 and rules made thereunder, and SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the EGM of the Company is being convened and will be conducted through VC.

The Notice of EGM has been sent, on 20th March 2024, only through electronic mode to all those members who have registered their email address with the Company/ Depository Participants in accordance with the aforesaid Circulars. Members may note that the Notice of EGM is also available on the website of the Company at https://www.anupengg.com/announcement/, BSE Limited at www.bseindia.com and the National Stock Exchange of India Limited at In case the members have not registered their email address, they can follow the below procedure:

The Members holding shares in DEMAT form are requested to register their e-mail address / electronic bank mandate with their respective Depository

The Members holding shares in Physical mode are requested to furnish their e-mail address / electronic bank mandate details in Form ISR-1 and other relevant forms pursuant to SEBI Circular bearing reference no. SEBI/HO/MIRSD/MIRSD-PoD-1/P/CIR/2023/37 dated March 16, 2023. Relevant details and forms prescribed by SEBI in this regard are available on the website of the Company at https://www.anupengg.com/updates/. Members whose Email IDs are not updated with the Company/Registrar and Share Transfer Agents/Depository Participants can avail soft copy of the EGM Notice by raising a request to the Company by email at investorconnect@anupengg.com.

Members can attend and participate in the EGM through VC/OAVM facility. The instructions for joining the EGM would be provided in the Notice of EGM. Members attending the meeting through VC/OAVM shall be counted for the purpose of reckoning the quorum under Section 103 of the Companies Act, 2013. The Company is also providing remote e-voting facility ('remote e-voting') to all its members to cast their votes on all the resolutions set out in the Notice of EGM. Also, the Company shall be providing the facility for voting through e- voting system during the EGM. The detailed procedure of remote e-voting / e-voting during

the EGM is mentioned in the Notice of EGM. In terms of the provisions of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 (as amended), Regulation 44 of SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations 2015 (as amended) and aforesaid circulars, the Company is pleased to offer its members the facility of "remote e-voting" provided by National Securities Depository Limited (NSDL) to exercise their right to vote on the business(es) as set forth in the Notice of the EGM. The facility of casting votes by a member using remote e-voting system as well as venue voting on the date of the EGM, on

the resolution set forth in the Notice, will be provided by NSDL. All the members are informed that: the Special Business as set out in the Notice of the EGM will be transacted through voting by electronic means;

the remote e-voting shall commence on Tuesday, 9th April 2024, at 09:00 A.M. (IST);

the remote e-voting shall end on Thursday, 11th April 2024, at 05:00 P.M. (IST);

iv. the cut-off date for determining the eligibility to vote by electronic means or at the EGM is Friday, the 5th April 2024.

any person holding shares in physical form and non-individual shareholders, who acquires shares of the Company and becomes member of the Company after the notice is send through e-mail and holding shares as on the cut-off date i.e. Friday, the 5th April 2024, may obtain the login ID and password by sending a request at evoting@nsdl.co.in or Company at investorconnect@anupengg.com. However, if you are already registered with NSDL for remote evoting, then you can use your existing user ID and password for casting your vote. If you forgot your password, you can reset your password by using "Forgot User Details/Password" or "Physical User Reset Password" option available on www.evoting.nsdl.com or call on 022 - 4886 7000. In case of Individual Shareholders holding securities in demat mode who acquires shares of the Company and becomes a Member of the Company after sending of the Notice and holding shares as on the cut-off date may follow steps mentioned in the Notice of the EGM under "Access to NSDL e-Voting system";

Members who have not voted through Remote E-voting facility will be permitted to vote through e-voting during the EGM; vii. The members who have already casted their vote through remote e-voting may attend the EGM through VC/OAVM but shall not be entitled to cast their vote

viii. All persons whose names are recorded in the Register of Members or in the Register of Beneficial Owners maintained by the Depositories as on the cut-off date namely Friday, the 5th April 2024, only shall be entitled to vote at the Extraordinary General Meeting by availing the facility of remote e-voting or by voting at the Extraordinary General Meeting. Members can cast their vote through remote e-voting or through e-voting during the EGM in the manner and by following the instructions as mentioned in the Notes section of the Notice dated 20th March 2024 convening the EGM.

ix. In case of any queries, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available at the download section of www.evoting.nsdl.com or call on toll free no.: 022 - 4886 7000 or send a request to Ms. Pallavi Mhatre, at evoting@nsdl.co.in. Members may also write to the Company Secretary at investorconnect@anupengg.com or at the Registered Office address. Members are advised to register/update their e-mail address with their DPs, in case of the shares held in electronic form and with the company and/or its RTA in

case shares held in physical form for receiving all communications, including Annual Report, Notices etc. by e-mail from the company in future. For The Anup Engineering Limited **Chintankumar Patel**

Company Secretary Membership No. A29326

financialexp.epapr.in

ICICI PRUDENTIAL MUTUAL FUND J'TARAKKI KAREINI

ICICI Prudential Asset Management Company Limited

Corporate Identity Number: U99999DL1993PLC054135

Registered Office: 12th Floor, Narain Manzil, 23, Barakhamba Road, New Delhi - 110 001. Corporate Office: ONE BKC, A - Wing, 13th Floor, Bandra-Kurla Complex, Bandra (East), Mumbai - 400 051; Tel.: +91 22 2652 5000, Fax: +91 22 2652 8100,

Website: www.icicipruamc.com, Email id: enquiry@icicipruamc.com Central Service Office: 2nd Floor, Block B-2, Nirlon Knowledge Park, Western Express Highway, Goregaon (E), Mumbai - 400 063. Tel.: 022 2685 2000 Fax: 022 26868313

Notice to the Investors/Unit holders of ICICI Prudential Ultra Short Term Fund, ICICI Prudential Long Term Bond Fund, ICICI Prudential Regular Savings Fund and ICICI Prudential Credit Risk Fund (the Schemes)

Notice is hereby given that ICICI Prudential Trust Limited, Trustee to ICICI Prudential Mutual Fund has approved the following distribution under Income Distribution cum capital withdrawal option (IDCW option) of the Schemes, subject to availability of distributable surplus on the record date i.e. on March 26, 2024*:

Name of the Schemes/Plans Quantum of IDCW NAV as on (₹ per unit) (Face value March 19, 2024 of ₹ 10/- each) \$# (₹ Per unit) ICICI Prudential Ultra Short Term Fund Quarterly IDCW 0.1982 11.0136 Direct Plan - Quarterly IDCW 0.2103 11.2235 **ICICI Prudential Long Term Bond Fund** Quarterly IDCW 12.5717 0.3686 Direct Plan - Quarterly IDCW 0.3945 12.9316 ICICI Prudential Regular Savings Fund Quarterly IDCW 0.3162 11.7330 14.4223 Direct Plan – Quarterly IDCW 0.4137 Half Yearly IDCW 0.6831 13.2662 17.0458 Direct Plan - Half Yearly IDCW 0.9396 ICICI Prudential Credit Risk Fund Quarterly IDCW 0.2607 11.1577 11.8279 0.2956 Direct Plan – Quarterly IDCW

\$ The distribution will be subject to the availability of distributable surplus and may be lower depending upon the extent of distributable surplus available on the record date under the IDCW option of the Schemes.

Subject to deduction of applicable statutory levy, if any

or the immediately following Business Day, if that day is a Non – Business Day.

The distribution with respect to IDCW will be done to all the unit holders/beneficial owners whose names appear in the register of unit holders/Statement of beneficial owners maintained by the Depositories, as applicable under the IDCW option of the Schemes, at the close of business hours on the record date.

It should be noted that pursuant to payment of IDCW, the NAV of the IDCW option of the Schemes would fall to the extent of payout and statutory levy (if applicable).

For ICICI Prudential Asset Management Company Limited

Place: Mumbai Date: March 20, 2024 No. 012/03/2024

Authorised Signatory

To know more, call 1800 222 999/1800 200 6666 or visit <u>www.icicipruamc.com</u> Investors are requested to periodically review and update their KYC details along with their mobile number and email id.

To increase awareness about Mutual Funds, we regularly conduct Investor Awareness Programs across the country. To know more about it, please visit https://www.icicipruamc.com or visit AMFI's website https://www.amfiindia.com

Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully.



Ahmedabad

OFFER OPENING PUBLIC ANNOUNCEMENT TO THE SHAREHOLDERS OF

FISCHER CHEMIC LIMITED

("FCL"/ "TARGET COMPANY" / "TC") Registered Office: 104, First Floor Raghuleela Mega Mall, Behind Poisar Depot, Kandivali West, Mumbai, Maharashtra, 400067; Phone No.: +91- 8655550209; Email id: <u>fischerchemicItd@gmail.com</u>; Website: <u>www.fischerchemic.in</u>

This Advertisement is being issued by Navigant Corporate Advisors Limited, on behalf of Time Medical International Ventures Pte Ltd (Acquirer-1), Mr. Shankar Varadharajan (Acquirer-2) and Mr. Ravindran Govindan (Acquirer-3) (Hereinafter collectively referred to as the "Acquirers") pursuant to regulation 18(7) of the Securities and Exchange Board of India (Substantial Acquisition of Shares and Takeovers) Regulations, 2011, as amended ("SEBI (SAST) Regulations") in respect of Open Offer ("Offer") for the acquisition up to 1,43,00,000 Equity Shares of Rs. 10/- each representing 26.00% of the expanded equity and voting share capital of the Target Company. The Detailed Public Statement ("DPS") pursuant to the Public Announcement ("PA") made by the Acquirers have appeared in Financial Express - English Daily (all editions); Jansatta - Hindi Daily (all editions); Mumbai Lakshadeep - Marathi Daily (Mumbai edition) on 22nd December, 2023.

- 1. The Offer Price is Rs. 12.00/- (Rupees Twelve only) per equity share payable in cash ("Offer Price").
- Committee of Independent Directors ("IDC") of the Target Company are of the opinion that the Offer Price of Rs. 12.00/-(Rupees Twelve only) offered by the Acquirers is in accordance with the relevant regulations prescribed in the Takeover Code and prima facie appear to be justified. The recommendation of IDC was published in the aforementioned newspapers on 20th
- March, 2024. There has been no competitive bid to this Offer.
- The completion of dispatch of The Letter of Offer ("LOF") to all the Public Shareholders of Target Company was completed on 15th March, 2024.
- Please note that a copy of the LOF is also available on the website of Securities and Exchange Board of India (SEBI), www.sebi.gov.in and also on the website of Manager to the Offer, www.navigantcorp.com and shareholders can also apply on plain paper as per below details:
- Open Offer as per the procedure along with other details. In terms of Regulation 16(1) of the SEBI (SAST) Regulations, the Draft Letter of Offer had been submitted to SEBI on 26th July, 2023. We have received the final observations in terms of Regulation 16(4) of the SEBI (SAST) Regulations from SEBI vide its Letter No. SEBI/HO/CFD/CFD-RAC-DCR1/P/OW/2024/9050/1 dated March 05, 2024 which have been incorporated in the

Eligible Person(s) may participate in the Offer by approaching their respective Broker/Selling Broker and tender Shares in the

- Any other material changes from the date of PA: Nil
- Schedule of Activities:

| Activity | Original Date | Original Day | Revised Date | Revised Day |
|---|---------------|--------------|---------------------|-------------|
| Public Announcement | 15.12.2023 | Friday | 15.12.2023 | Friday |
| Publication of Detailed Public Statement in newspapers | 22.12.2023 | Friday | 22.12.2023 | Friday |
| Submission of Detailed Public Statement to BSE, Target | 22.12.2023 | Friday | 22.12.2023 | Friday |
| Company & SEBI | | | | |
| Last date of filing draft letter of offer with SEBI | 01.01.2024 | Monday | 01.01.2024 | Monday |
| Last date for a Competing offer | 15.01.2024 | Monday | 15.01.2024 | Monday |
| Receipt of comments from SEBI on draft letter of offer | 22.01.2024 | Monday | 05.03.2024 | Tuesday |
| Identified date* | 24.01.2024 | Wednesday | 07.03.2024 | Thursday |
| Date by which letter of offer be posted to the shareholders | 01.02.2024 | Thursday | 15.03.2024 | Friday |
| Last date for revising the Offer Price | 06.02.2024 | Tuesday | 20.03.2024 | Wednesday |
| Comments from Committee of Independent Directors of Target | 06.02.2024 | Tuesday | 20.03.2024 | Wednesday |
| Company | | | | |
| Advertisement of Schedule of activities for open offer, status of | 07.02.2024 | Wednesday | 21.03.2024 | Thursday |
| statutory and other approvals in newspapers and sending to | | | | |
| SEBI, Stock Exchange and Target Company | | | | |
| Date of Opening of the Offer | 08.02.2024 | Thursday | 22.03.2024 | Friday |
| Date of Closure of the Offer | 22.02.2024 | Thursday | 08.04.2024 | Monday |
| Post Offer Advertisement | 29.02.2024 | Thursday | 18.04.2024 | Thursday |
| Payment of consideration for the acquired shares | 07.03.2024 | Thursday | 25.04.2024 | Thursday |
| Final report from Merchant Banker | 15.03.2024 | Friday | 03.05.2024 | Friday |

would be sent. All owners (registered or unregistered) of equity shares of the Target Company (except the Acquirers and Selling Company) are eligible to participate in the Offer any time before the closure of the Offer.

Capitalized terms used in this announcement, but not defined, shall have the same meaning assigned to them in the PA, DPS and ISSUED BY MANAGER TO THE OFFER FOR AND ON BEHALF OF THE ACQUIRERS

NAVIGANT CORPORATE ADVISORS LIMITED

804, Meadows, Sahar Plaza Complex, J B Nagar, Andheri Kurla Road, Andheri East, Mumbai - 400059. **Tel No.** +91 22 4120 4837 / 4973 5078 Email id: navigant@navigantcorp.com Website: www.navigantcorp.com SEBI Registration No: INM000012243 Contact person: Mr. Sarthak Vijlani

Navigant Place: Mumbai

Date: March 20, 2024

∳∆લ્∀ા આવાસ ફાયનાન્સિયર્સ લીમીટેડ

_____ (અગાઉ એયુ હાઉસીંગ ફાયનાન્સ લીમીટેડ તરીકે જાણીતી) (CIN:L65922RJ2011PLC034297) રજી. અને કોર્પો. ઓફીસ : ૨૦૧-૨૦૨, બીજો માળ, સાઉથ એન્ડ સ્ક્વેર, માનસરોવર ઇન્ડસ્ટ્રીયલ એરિયા, જ્યપુર-૩૦૨૦૨૦

કળજા નોટીસ જત જણાવવાનું કે નીચે સહી કરનાર **આવાસ ફાયનાન્સિયર્સ લીમીટેડ (અગાઉ "એયુ હાઉસીંગ ફાયનાન્સ લીમીટેડ તરીકે જાણીતી")** ના અધિકૃત અધિકારીએ સિક્ચોરિટાઇઝેંશન અને રિકન્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્ચોરિટી ઇન્ટરેસ્ટ એક્ટ,૨૦૦૨ હેઠળ અને સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ (એન્કોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૯ સાથે વંચાતી કલમ ૧૩(૧૨) હેઠળ મને મળેલ સત્તાનો ઉપયોગ કરીને જણાવેલ નોટીસની બજવણીની તારીખથી દ્ . દિવસેની અંદર સબંધિત નોટીસમાં નીચે જણાવલે રકમ ચુકવી જવો દેવાદારોને માંગણાં નોટીસ પાઠવી હતી. દેવાદારો રકમની પરત ચુકવણી કરવામાં નિષ્ફળ જતાં જણાવેલ નિચમોના નિચમ ૯ સાથે વંચાતી જણાવેલ કાચદાની કલમ ૧૩(૪) હેઠળ મળેલી સત્તાની રૂએ નીચે જણાવેલે મિલકતોનો કબજો નીચે જણાવેલ તારીખોએ લઇ લીધો છે. ખાસ કરીને દેવાદારો અને જામીનદારોને અને જાહેર જ્વતાને અહી સાવધ કરવામાં આવે છે કે મિલકતો સાથે કોઇ વ્યવહાર કરવો નહી અને મિલકત સાથેનો કોઇ પણ વ્યવહાર **આવાસ ફાયનાન્સિયર્સ લીમીટેક (અગાઉ "એયુ હાઉસીંગ ફાયનાન્સ લીમીટેક તરીકે જાણીતી")** ના અહીં નીચે ભાવેલ ૨કમ અને તેના પરનાં ચડત વ્યાજને આધિન ૨હેશે

| દેવાદારનું નામ | માંગણા નોટીસની તારીખ અને રકમ | મિલકતની વિગત | કબજા નોટીસની તારીખ અને પ્રકાર |
|--|--|---|--|
| અલાભાઇ કરાંગીયા, હિના આલા કરાંગીયા (A/c No.) LNJAM16822-230252433 | ૦૯−૦૧−૨૦૨૪ રૂા. ૨૧૭૫૫૧/− ૦૪−૦૧−૨૦૨૪ મુજબ | જપાવાડો પાડો, હાઉસ નં. ૭, મેઇન બજાર રોડ, સામોર બીઓ, જામનગર, ગુજરાત–3દ્૧૩૧૦, ક્ષેત્રફળ ૧૦૦૦ ચો. ફટ (૯૨.૯૦ ચો.મી .) | ૧૯–૦૩–૨૪ નાં રોજ સાંકેતિક કબજો લીધો |
| સ્થળ : જથપુર તારીખ : ૨૧–૦૩–૨૦૨૪ | | અધિકૃત અધિકારી આવાસ ફાયનાન્સિ | ાચર્સ લીમીટેડ |

| UNITY Small Finance Bank | યુનિટી સ્મોલ ફાચનાન્સ બેંક લીમીટેડ જીસ્ટર્ડ ઓફીસ : બર્સત લોક, વર્સત વિહાર, નવી દિલ્હી-૧૧૦૦૫૦ | કબજા નોટીસ |
|--------------------------|---|-----------------------------------|
| - OILIII Bank | કોર્પોરેટ ઓફીસઃ સેન્ટ્રમ હઉસ, વિદ્યાનગરી માર્ગ, કલિના, સાન્તાકૃઝ (ઇ) મુંબઇ– ૪૦૦ ૦૯૮. | (સ્થાવર મિલકત માટે) જુઓ નિયમ ૮(૧) |
| .0 0 0 | , | 0 10 1. 10 . 1 |

આથી, યુનિટી સ્મોલ ફાયનાન્સ બેંક લીમીટેડના નીચે સહી કરનાર અધિકૃત અધિકારીએ સિક્ચોરીટાઇઝેશન અને રીકન્સ્ટ્રક્શન ઓફ સંચલ એસેટસ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, રૅ૦૦૨ હેઠળ અને સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમે ૨૦૦૨ ના નિયમ ૩ સાથે વંચાતી કલમ ૧૩ (૧૨) હેઠળ પ્રાપ્ત સત્તાનો ઉપયોગ કરીને માંગણા નોટીસ જારી કરી દેવાદારો/સહદેવાદારો/ અને જામીનદારોને નોટીસમાં જણાવેલ રકમ આ નોટીસ મળ્યાની તારીખથી ૬૦ દિવસની અંદર ચુકવવા જણાવ્યું હતું. દેવાદારો/સહ–દેવાદારો/ અને જામીનદારો રકમની પરત ચુકવણી કરવામાં નિષ્ફળ ગયા હોવાથી દેવાદારો જામીનદારો અને જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે નીચે સહી કરનારે જણવેલ નિયમોના નિયમ ૮ સાથે વંચાતી જણવેલ એક્ટની કલમ ૧૩(૪) હેઠળ તેમને પ્રાપ્ત સત્તાનો ઉપયોગ

કરીને અહીં નીચે જણાવેલ મિલકતનોનો ભૌત્તિક કબજો **૧./૦૩/૨૦૨૪** ના રોજ લઇ લીધો છે. આથી ખાસ કરીને દેવાદારો અને જામનદારો અને જાહેર જનતાને મિલકતો સાથે કોઇપણ પ્રકારનો સોદો ન કરવા સાવધ કરવામાં આવે છેઅને મિલકત સાથેનો કોઇપણ સોદો યુનિટી સ્મોલ ફાયનાન્સ બેંક લીમીટેડની નીચે જણાવેલ ૨કમ અને તેના પરના વ્યાજના ચાર્જને આદિન રહેશે.

સિક્ચોર્ડ મિલકત પરતે મેળવવા માટે ઉપલબ્ધ સમચના સંબંધમાં એક્ટની કલમ ૧૩ ની પેટા કલમ ૮ ની જોગવાઇઓ પ્રત્યે દેવાદારો / સહ-લાદારો/જામીનદારોનં ધ્યાન દોરવામાં આવે છે

| દેવાદાર/સહ–દેવાદાર/જામીનદારનું નામ અને | ગીરો /સિક્ચોર્ડ એસેટ(ટો) | માંગણાં નોટીસની તારીખ |
|---|--|--|
| લોન એકાઉન્ટ નંબર | મિલકતની વિગત | અને બાકી રકમ |
| ૧. શ્રીમતી ગીતાબેન જિતેન્દ્રભાઇ ચૌહાણ, ૨. શ્રી જિતેન્દ્રભાઇ જસુભાઇ ચૌહાણ લોન એકાઉન્ટ નં. : CFSLAHDLOAN00005002256 | ગ્રામ પંચાયત હાઉસ નં. ઝલ્, પ્લોટનું ક્ષેત્રફળ ૧૫ ગુણ્યા ૪૫ ચો. ફુટ અને બાંધકામ એરિયા, અને મુકામ-મોજે-ખાકસર, તાલુકો-તારાપુર, રજીસ્ટ્રેશન જિલો–આણંદ અને પેટા જિલો–આણંદ ખાતેની સ્થાવર મિલકતના તમામ ભાગ અને હિસ્સા નીચે મુજબ છે : ચતુઃસીમા : (ગીરો ડિંડ મુજબ) ઉત્તર : જાહેર રોડ, દિક્ષણ : કુવરબેન ઘુડાભાઇ ચૌહાણનું ઘર, પુર્વ : પ્રતાપભાઇ ભીખાભાઇ ચૌહાણનું ઘર, પશ્ચિમ : નવલભાઇ જસુભાઇ ચૌહાણનું ઘર | તારીખ ૧૨.૧૦.૨૦૨૩ |
| તારીખ: ૨૧/૦૩/૨૦૨૪ સ્થળ: આણંદ, ગજરાત | | 1/– અધિકૃત અધિકારી, કાયનાન્સ બેંક લીમીટેડ |



સુર્યોદય સ્મોલ ફાયનાન્સ બેંક લીમીટેડ

રજી. અને કોર્પો. ઓફીસ : ૧૧૦૧, શારદા ટેરેસીસ, પ્લોટ દ્રપ, સેક્ટર-૧૧, સીબીર્ડ બેલાપુર, નવી મુંબઇ-૪૦૦૬૧૪. CIN: L65923MH2008PLC261472.

પરિશિષ્ટ-૪ (નિયમ ૮(૧)) કબજા નોટીસ (સ્થાવર મિલકત માટે) આથી મેસર્સ સુર્યોદય સ્મોલ ફાયનાન્સ બેંક લીમીટેડના નીર્ચ સહી કરનાર અધિકૃત અધિકારીએ સિક્યોરીટાઇગ્રેશન અર્ન રીકન્સ્ટ્રક્શન ઓફ્ ફાયનાન્સિયલ એસ્ટેટ્સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ (૨૦૦૨ ના એક્ટ નં. ૫૪) અને સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એન્ડ્રોસંમેન્ટ) નિચમો, ૨૦૦૨ ના નિચમ ૩ સાથે વંચાતી કલમ ૧૩(૧૨) હેઠળ પ્રાપ્ત સત્તાનો ઉપયોગ કરીને નીચે જ્યાવેલ દેવાદાર/રો જામીનદાર/રોને માંગણા નોટીસ જારી કરી આ નોટીસ મળ્યાની તારીખથી ૬૦ દિવસની અંદર નોટીસમાં જ્ણાવેલ ૨૬મ પરત કરવા જ્ણાવ્યું હતું આથી દેવાદાર/રો/જમીનદાર/રો રકમ પરત ચુકવવામાં નિષ્ફળ ગયા હોવાથી દેવાદાર/રો જમીનદાર/રો અને જાહેર જનતાને જાણ કરવામાં આવે

| | છે કે નીચે સહીં કરનારે સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ દુ અને ૮ સાથે વંચાતી જણાવેલ એક્ટની કલમ ૧૩(૪) હેટળ તેમને પ્રાપ્ત સત્તાનો ઉપયોગ કરીને અહીં નીચે જ્યાવેલ મિલકતનો કબજો નીચે જ્યાવેલ તારીખોએ લઈ લીધો છે. | | | | | |
|-------------|--|-------------------------|----------------------------|----------------------|--|--|
| ક્રમ નં. | દેવાદાર/સહ–દેવાદાર/ જામીનદારનું નામ | માંગણા નોટીસની તારીખ | કુલ બાકી રકમ (રૂા.) માં | ભૌત્તિક કબજાની તારીખ | | |
| | લોન નં. ૨૧૭૦૭૦૦૦૨૭૪૯ | 90-99-2022 | રૂા. ૨૧૪૦૯૮૦૪.૫૮/– | ૧૭– ૦૩–૨૦૨૪ | | |
| | ૧) સરફરાઝ મહમંદશરિફ શેખ, ૨) શ્રીમતી સફનાબેન મહમંદશરિક શેખ | | ૧૯/૧૦/૨૦૨૨ મુજબ | | | |

સિક્ચોર્ડ અસ્ક્ચામત(તો)/સ્થાવર મિલકત(તો) ની વિગત : પ્લોટ નં. ૧૬, ક્ષેત્રફળ ૬૮.૦૪ ચો. ચાર્ડ અંદાજે ૫૬.૮૯ ચો.મી., (કે.જે.પી મુજબ બ્લોક નં. ૬૫/૧૬ ક્ષેત્રફળ ૫૬.૮૯ ચો.મી., 'મદિના રેસિડેન્સી', મુકામ–રેવન્યુ સર્વે નં. ૮૩, રેવન્યુ સર્વે નવો બ્લોક નં. ૬૫, જુનો બ્લોક નં. ૩૭૫. ક્ષેત્રફળ ૦–૬૪–૨૧ ચો.મી., મોજે–ગામ–ધોરણપારડી, તાલુકો–કામરેજ, જિલો–સુરત–૩૯૪૧૫૦ ખાતેની મિલકત. ચતુઃસીમા : પુર્વ : બ્લોક નં. ૫૭, પશ્ચિમ : સોસાયટીનો અંદરનો રોડ, ઉત્તર : પ્લોટ નં. ૧૭, દક્ષિણ : સોસાયટીનો અંદરનો રોડ

ખાસ કરીને દેવાદાર/રો/ જામીનદાર/રો અને જાહેર જુનતાને મિલકત સાથે કોઇ સોદો ન કરવા સાવધ કરવામાં આવે છે અને મિલકત સાથેન કોઇપણ સોદા મેસર્સ સુર્યોદય સ્મોલ ફાયનાન્સ બેંક લીમીટેડની ઉપર જણાવેલ માંગણાની રકમ અને તેના પરના ચડત વ્યાજના ચાર્જને આધિન સિક્ચોર્ડ એસેટ પરત મેળવવા માટે ઉપલબ્ધ સમચના સંબંધમાં એક્ટની કલમ ૧૩ ની પેટા કલમ (૮)ની જોગવાઇઓ પ્રત્યે દેવાદારોનું ધ્યાન દોરવામ

આવે છે. સહી/– અધિકૃત અધિકારી સુર્યોદય સ્મોલ ફાયનાન્સ બેંક લીમીટેડ વતી સ્થળ: જિલો સુરત, ગુજરાત તારીખ: ૨૧-૦૩-૨૦૨૪



દ્ય અનુપ એન્જીનિયરીંગ લીમીટેડ

CIN: L29306GJ2017PLC099085

૨૪૪૨૮ર્ડ ઓફીસ : ૬૬ કેવી ઇલેક્ટ્રીક સબ-સ્ટેશન પાછળ, ઓઢવ રોડ, અમદાવાદ-૩૮૨ ૪૧૫ કોન: +૯૧-૭૯-૪૦૨૫ ૮૯૦૦ કેક્સ: +૯૧-૭૯-૨૨૮૭ ૦૬૪૨

કંપનીની અસાદ્યારણ સામાન્ય સભાની નોટીસ

આથી નોટીસ આપવામાં આવે છે કે અનુપ એન્જિનેચરિંગ લીમીટેડ (કંપની) ના સભ્યોની અસાધારણ સામાન્ય સભા (ઈજીએમ/સભા) શુક્રવાર, ૧૨ એપ્રિલ, ૨૦૨૪ ના રોજ સવારે ૧

વિડિયો કોન્ફરન્સ (વીસી)/અન્ય ઓડિયો વિઝયુઅલ માધ્યમો (ઓએવીએમ) મારફત ઇજીએમની નોટીસ તારીખ ર૦ માર્ચ, ૨૦૨૪ માં જણાવેલ કાર્ય (ર્યો) પાર પાડવા માટે યોજાશે. કોર્પોરેટ અર્કર્સ મંત્રાલય (એમસીએ) દ્વારા જારી કરાયેલ જનર સરક્યુલર નં. ૧૪/૨૦૨૦ તારીખ ૮ એપ્રિલ, ૨૦૨૦ સાથે વંચાતા ૦૯/૨૦૨૩ તારીખ ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૩ સહીતના અન્ય સંબંધિત પરિપત્રો (અહી પછી એક સાથે એમસીએ પરિપત્રો તરીકે દર્શાવેલ છે) અન્વયે અને સિક્યોરીટીઝ અને બોર્ડ ઓફ ડાયેરક્ટર્સે તેના સરક્યુલર નં. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 તારીષ્ ૧૨ મે, ૨૦૨૦, સરક્યુલર નં. SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 તારીખ ૧૫ જાન્યુઆરી, ૨૦૨૧, સરક્યુલર નં. SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62 તારીખ ૧૩ મે, ૨૦૨૨, સરક્યુલર નં. SEBI/HO/CFD/PoD-2/P/CIR/2023/4 તારીખ ૫ જાન્યુઆરી, ૨૦૨૩ અને સરક્યુલર નં. SEBI/HO/CFD/PoD-2/P/CIR/2023/167 તારીખ ૦૭ ઓક્ટોબર, ૨૦૨૩ (અહીં પછી એક સાથે સેબી પરિપગ્રો તરીકે દર્શાવેલ છે) દ્વારા કંપનીઓને વીસી અથવા અન્ય ઓડિયો વિગ્ર્યુઅલ મારફત તેમાં જણાવેલ વિધિ શરતોના અનુપાલનને આધિન ઇજીએમ યોજવા પરવાનગી આપેલ છે ઉપરોક્ત એમસીએ પરિપત્રો અને સેબી પરિપત્રોના અનપાલનાર્થે અને કંપની કાયદા, ૨૦૧૩ની જોગવાઇઓ અને તે હેઠળ બનેલ નિયમ, અને સેબી (લિસ્ટીંગ ઓબ્લીગેશન્સ અને ડિસક્લોઝર રીક્વકયારમેન્ટ્સ) નિયમનો, ૨૦૧૫ અન્વયે, કંપનીની ઈજીએમ બોલાવાઈ રહી છે અને વીસી મારફત યોજાશે.

ઈજીએમની નોટીસ ઉપરોક્ત પરિપત્રો મુજબ તમામ સભ્યો જેમણે કંપની/ડિપોઝીટરી પાર્ટીશીપન્ટોને તેમના ઇમેઇલ એડ્રેસ રજીસ્ટર્ડ કરાવલે છે તેઓને ૨૦ માર્ચ, ૨૦૨૪ના રોજ ફક્ત ઇલેક્ટ્રોનિક માદચમથી મોકલેલ છે. સભ્યોએ નોંધ લે વી કે ઈજ઼એમની નોટીસ કંપનીની વેબસાઇટ https://www.anupengq.com/announcement બીએસઇ લીમીટેડની www.bseindia.com અને નેશનલ સ્ટોક એક્સરોન્જ લીમીટેડની www.nseindia.com પર પણ ઉપલબ્ધ રહેશે.

સભ્યોએ તેમના ઈમેઇલ એડ્રેસ ૨જીસ્ટર્ડ કરાવેલ નથી, તેઓ નીચેની પ્રક્રિયા અનુસરી શકે છે:

- ડિમેટ સ્વરુપે શેર હોલ્ડીંગ ધરાવતા સભ્યો તેમના ઇમેઈલ એડ્રેસ/ ઇલેક્ટ્રોનિક બેંક મેન્ડેટ વિગતો તેના ડિપોઝીટરી પાર્ટીશીપન્ટ પાસે રજીસ્ટર કરાવા વિનંતી છે.×
- ફીઝીકલ સ્વરુપે શેર હોલ્ડીંગ ધરાવ તા સભ્યોને સેસબી સરસ્ક્યુલર નં. SEBI/HO/MIRSD/MIRSD-PoD-1/P/CIR/2023/37 તારીખ ૧૬ માર્ચ, ૨૦૨૩ અન્વયે ફોર્મ નં. આઈએસઆર-અને અન્ય સંબંધિત ફોર્મમાં પુરા પાડવા વિનંતી છે. સંબંધિત વિગતો અને આ સબંધમાં સેબી દ્વારા નિચત ફોર્મ કંપનીની વેબસાઈટ https://www.anupengg.com/updates ઉપર ઉપલબ્ધ છે. [ે] સભ્યોના ઇમેઇલ આ ઇડી કંપની/રજીસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટો/ડિપોઝીટરી પાર્ટીશીપન્ટો પાસે સુધરાવેલ નથી તેઓ કંપનીને investorconnect@anupengg.com ઉપર અરજી ઇમેઇલ કરીને

ક્ષભ્યો વીસી/ઓએવીએમ સવલત મારફત ઈજીએમમાં હાજર રહી શકે છે અને ભાગ લઈ શકે છે. ઈજીએમમાં જોડવાની સુચનાઓ ઈજીએમની નોટીસમાં આપેલ છે. વીસી/ઓએવીએમ મારફત સભામ

કાજ્ટ રહેનાર સભ્યોને કંપની કાયદા, ૨૦૧૩ ની કલમ ૧૦૩ હેઠળ કોરમની ગણતરી માટે ધ્યાનમાં લેવામાં આવશે. કંપની ઇજીએમની નોટીસમાં જણાવેલ તમામ ઠરાવો પર તેના સભ્યોને તેમના મત આપવા માટે રીમોટ ઇ-વોટીંગ સવલત (રીમોટ ઇ-વોટીંગ) પણ પુરી પાડી રહી છે. આ ઉપરાંત કંપની ઈજીએ દરમિયાન ઇ–વોટીંગ સીસ્ટમ મારફત મતદાનની સવલત પુરી પાડીરહીછે. રીમોટ ઇ–વોટીંગ/ઇજીએમ દરમિયાન ઇ–વોટીંગની વિગતવાર પ્રક્રિયા ઇજીએમની નોટીસમાં જણાવેલ છે. કંપની કાયદા, ૨૦૧૩ ની કલમ ૧૦૮ ની જોગવાઈઓ સાથે વંચાતા કંપની (વ્યવસ્થાપન અને પ્રશાસન) નિયમો, ૨૦૧૪ (સુધારેલ) ના ચિનમ ૨૦, સેબી (લિસ્ટીંગ ઓબ્લીગેશન્સ અને ડિસક્લોઝ રીક્વાચરમેન્ટ્સ) નિચમનો, ૨૦૧૫ (સુધારેલ) ના નિચમન ૪૪ અને ઉપરોક્ત પરિપગ્રો અંતર્ગત, કંપની તેના સભ્યોને ઈ જીએમની નોટીસમાં જણાવેલ કાર્ય(ર્યો) પર મત આપવા માટે તેમના ૯કને

- ઉપયોગ કીરને નેશનલ સિક્યોરીટીઝ લીમીટેડ (એનએસડીએલ) દ્વારા અપાયેલ રીમોટ ઈ-વોટીંગની સુલત તેના સભ્યોને આપતા આનંદ અનુભવે છે. નોટીસમાં જ્ણાવેલ ઠરાવો પર રીમોટ ઈ-વોટીંગ સીસ્ટમનો ઉપયોગ કરીને તેમજઈજીએમની તરીખે સ્થળ પર સભ્યો દ્વારા મત આપવાની સવલત એનએસડીએલ દ્વારા પુરી પાડવામાં આવશે.
- **૧**. ઈજીએમની નોટીસમાં જણાવેલ ખાસ કામકાજો ઇલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા મતદાનથી પાર પાડવામાં આવશે. ૨. રીમોટ ઈ–વોટીંગ મંગળવાર, ૯ એપ્રિલ, ૨૦૨૪ ના રોજ સવારે ૦૯.૦૦ વાગ્યે શરૂ થશે.
- 3. રીમોટ ઈ–વોટીંગ ગુરુવાર, ૧૧ એપ્રિલ, ૨૦૨૪ ના રોજસાંજે ૦૫.૦૦ વાગ્ચે બંધ થશે.
- ૪. ઇલેક્ટ્રોનિક માધ્યમાં દ્વારા અને ઇજીએમ ખાતે મત આપવા માટે લાચકાત નક્કી કરતી કટ–ઓફ તારીખ શુક્રવાર, ૫ એપ્રિલ, ૨૦૨૪ છે.
- . ફોઝીકલ સ્વરપે શેરહોલ્ડિંગ ધરાવતી કોઇપણ વ્યક્તિ અને નોન- ઇન્ડીયુઝઅલ શેરહોલ્ડર્સ, જેમણે ઇમેઇલથી નોટીસ મોકત્યા પછી કંપીના શેર પ્રાપ્ત કરેલ છે અને કંપનીના સભ્ય બનેલ છે અને કટ–ઓફ તારીખ એટલે કે શુક્રવાર, ૫ એપ્રિલ, ૨૦૨૪ ના રોજ શેરહોર્લ્ડીંગ ધરાવે છે, તેઓ evoting@nsdl.co.in અથવા કંપનીને investorconnect@anupengg.com ઉપર અરજી મોકલીને લોગીન આઈડી અને પાસવર્ડ મેળવી શકે છે. આમ છતાં, જો તમે પહેલેથી એનએસેડીએલમાં રીમોટ ઈ-વોટીંગ માટે રજીસ્ટર્ડ છો તો તમે તમારા ચાલુ યૂઝરઆઈડી એ પાસવર્ડનો તમારા મત આપવ માટે ઉપયોગ કરી શકો છો. જો તમે www.evoting.nsdl.com ઉપર તમારો પાસવર્ડ ભુલી ગયા છો તો ફોરગેટ યૂઝર ડિટેઈલ્સ/પાસવર્ડ અથવા ફીઝીકલ યૂઝર રીસેટ પાસવર્ડ વિક્લપનો ઉપયોગ કરીને તમારો પાસવર્ડ ફરી બનાવી શકો છો અથવા ૦૨૨૪૮૮૬–૭૦૦૦ ને કોલ કરી શકો છો. નોટીસ મોક્યા પર્છો ડિમેટ સ્વરૂપે શેર હોલ્ડીંગ સસિક્યોરીટી ઘરાવતી અને કંપનીની સભ્ય બનનાર અને કટ–ઓક તરીખના રોજ શેર હોલ્ડીંગ ધરાવતી વ્યક્તિ એક્સેસ ટ્ર એનએસડીએલ ઇ–વોટીંગ સીસ્ટમ હેઠળ ઈછુએમની નોટીસમાં જ્ણાવેલ પગલા અનુસરી શકે છે.
- જે સભ્યોએ રીમોટ ઈ-વોટીંગ સવલત મારકત મત આપેલ નથી તેઓને ઈજાએમ દરમિયાન ઈ-વોટીંગ મારકત મત આપવાની પરવાનગી મળશે.
- . જેસભ્યોએ રીમોટ ઈ-વોટીંગ મારફત પહેલેથી મત આપેલ છે તેઓ વીસી/ઓએવીએમ મારફત ઈજીએમમાં હાજર રહી શકે છે, પરંતુ, ઈજીએમ દરમિયાન તેમના મ ત આપવા હકદાર ગણાશે નહી . તમામ સભ્યો જેમના નામો કટ–ઓફ તારીખ એટલે કે શુક્રવાર, ૫ એપ્રિલ, ૨૦૨૪ ના રોજ રજીસ્ટર ઓફ મેમ્બર્સ અથવા ડિપોઝીટરીઓ દ્વારા સંચાલિત લાભાર્થી માલિકોના રજીસ્ટરમાં નોંધાચેલ છે કક્ત તેઓજરીમોટ ઈ–વોટીંગની સવલત પ્રાપ્ત કરીને એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ મીટીંગમાં મત આપવા અને એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ મીટીંગમાં મત આપવા હકદાર ગણાશે. સભ્યો ઈજીએ બોલાવતી નોટીસ તારીખ ૨૦ માર્ચ, ૨૦૨૪ ના નોંધ વિભાગમાં જણાવ્યા મુજબ સુચનાઓ અનુસરીને અને પદ્ધતિથી રીમોટ ઈવોટીંગ અથવા ઇજીએમ દરમિયાન ઈ–વોટીંગ મારફત તેના મત
- કોઇપણ પુછપરછ માટે તમે www.evoting.nsdl.com 🛮 ના ડાઉનલોડ સેક્શન પર ઉપલબ્ધ શેરહોલ્ડરો માટેના ફીકવન્ટલી આસ્કડ ક્વેશ્વન્સ(એફ્એક્ચ્રેશ) અને ઇ–વોટીંગ યુઝર મેન્યુઅલ જોઈ શકો છો અથવા ટોલફી નં. ૦૨૨– ૪૮૮૬ ૭૦૦૦ ઉપર કોલ કરવો અથવા મેસર્સ પલવી મહાગ્રેને evoting@nsdl.co.in ઉપર અરજી મોકલવી. સભ્યો કંપની સેક્ટરીને investorconnect@anupengg.com અથવા ૨જીસ્ટર્ડ ઓફીસના સરનામે પણ લખી શકે છે.

મભ્યોને ભવિષ્યમાં કંપની પાસેથી ઇમેલ દ્વારા તમામ પગવ્યવહારો, વાર્ષિક અહેવાલો, નોટીસો વગરે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે શેરહોલ્ડીંગના કિસ્સામાં તેમા ડીપી પાસે અને ફીઝીકલ સ્વરૂપે શેરહોલ્ડીંગન કિસ્સામાં કંપની અને/અથવા તેના આરટીએ પાસે તેમના ઇમેઇલ એડ્રેસો રજીસ્ટર/સુધારો કરાવવા વિનંતી છે.

દ્ય અનુપ એન્જીનિચરીંગ લીમીટેડ વતી ચિંતનકુમાર પટેલ સ્થળ : અમદાવાદ તારીખ : ૨૦.૦૩.૨૦૨૪ મેમ્બરશીપ નં. એરલ્૩૨૬ केनरा बैंक Canara Bank 📣

એસેટ્ રીકવરી મેનેજમેન્ટ શાખા, હમો માળ, ગીફ્ટ વન ટાવર, ગીફ્ટ સીટી, ગાંધીનગર - ૩૮૨૩૫૫

ટેન્ડરો આમંત્રિત કરીને જંગમ વસ્તુઓના વેચાણ નોટિસ

આથી નોટિસ આપવામાં આવે છે કે અહીં વર્ણવેલ જંગમ મિલકતો, સિક્ચોરિટાઇઝેશન એન્ડ रिङन्स्ट्रड्शन ऑइ इाछनान्शियल એसेट्स अने એन्झोर्सभेन्ट ऑइ सिड्योरिटी छन्टरेस्ट એક્ટ २००२ અને સિક્ચુરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ ૨૦૦૨ની જોગવાઈઓ હેઠળ કબજો મેળવ્યો છે, તે ટેન્ડરો આમંત્રિત કરીને વેચવામાં આવશે નીચે દર્શાવેલ જંગમ વસ્તુઓના વેચાણ માટે ઇચ્છુક ટેન્ડરર પાસેથી નીચે જણાવેલ નિયમો અને

શરતો પર સીલબંધ ટેન્ડરો મંગાવવામાં આવે છે.

- . **સિક્ચોરેડ ક્રેડિટરનું નામ અને સરનામું** : કેનરા બેંક, એસેટ્ રીકવરી મેનેજમેન્ટ શાખા, ૭મો માળ, ગીફ્ટ વન ટાવર, ગીફ્ટ સીટી, ગાંધીનગર – ૩૮૨૩૫૫
- ૨. લેનારા(ઓ)/ બાંચધરી(ઓ)નાં નામ :
- ૧. મેસર્સ સિયારામ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ (પાર્ટનરશિપ ફર્મ) ૨. શ્રી રમેશ ગણેશભાઈ જીવાણી ૩. શ્રી વાલમજીભાઈ માધવજીભાઈ સાનિયારા ૪. શ્રી મનસુખભાઈ માધવજીભાઈ ભાલોડિયા ૫. શ્રીમતી હર્ષાબેન બળવંતભાઈ આદ્રોજા ૬. શ્રીમતી વિલાસબેન ચંદુલાલ આદ્રોજા ૭. શ્રી વસંતભાઈ ગણેશભાઈ જીવાણી
- 3. કુલ દેણાની રકમ : રૂ. ૨७,૫૮,૦૦૯.૮૫ તા.૨૯.૦૨.૨૦૨૪ સુધીના ત્યારબાદ ચડત વ્યાજ અને ચાર્જાસ
- ૪. ટેન્ડર પ્રાપ્ત કરવાની છેલ્લી તારીખ :- ૨૪.૦૪.૨૦૨૪
- **૫. ટેન્ડર રજૂ કરવાનું સરનામું**:- એસેટ્ રીક્વરી મેનેજમેન્ટ શાખા, સાતમો માળ, ગીફ્ટ વન ટાવર, ગીફ્ટ સીટી, ગાંધીનગર – ૩૮૨૩૫૫
- ટેન્ડર ખુલવાની તારીખ : ૨૫.૦૪.૨૦૨૪ ક. (અ)
 - ટેન્ડર ખુલવાનું સ્થળ : એસેટ્ રીક્વરી મેનેજમેન્ટ શાખા, સાતમો માળ ગીફ્ટ વન ટાવર, ગીફ્ટ સીટી, ગાંધીનગર – ૩૮૨૩૫૫

વસ્તુઓના નામઃ લોખંડની સીડી, સીલીંગ ફેન, કોમ્પ્રેસર સાથે હિટાચી એસી, ટીવી સેન્સુઇ, કેનન પ્રિન્ટર, સોફા સેટ (૫ સીટર), સોફા સેટ (૭ સીટર), ઓફિસ ટેબલ, રિવોલ્વીંગ ચેર, એક્ઝોસ્ટ ફેન, પ્લાસ્ટીકની ખુરશીઓ, નાના વજનના સ્કેલ, સિમેન્ટ મિશ્રણ મશીન , ઓઇલ ડ્રમ્સ સ્ટીલ – ૪૩ અને મિસ્ક સ્ક્રેપ વગેરે (મોરબી ખાતે સ્થિત)

૮. અનામત કિંમત :- રૂ ૫૦,૦૦૦/-

૯. અન્ય નિયમો અને શરતો

કંપની સેક્રેટરી

એ) વસ્તુઓ "જ્યાં છે તે પ્રમાણે"ની શરતમાં વેચવામાં આવશે. બી) વસ્તુઓને અનામત કિંમતથી નીચે વેચવામાં આવશે નહીં. સી)ઉધાર લેનારને ૨૪.૦૪.૨૦૨૪ સધી ઉપરોક્ત આઇટમ્સ દુર કરવાનો અધિકાર છે જે નિષ્ફળ જાય તો તે ૨૫.૦૪.૨૦૨૪ ના રોજ વેચવામ આવશે. ડી) વસ્તુઓનું ૧૬.૦૪.૨૦૨૪ ના રોજ નિરીક્ષણ કરી શકાશે. ઈ)ઇચ્છુક ટેન્ડરરે તેમના ટેન્ડરોને સાદા કાગળ પર સીલબંધ કવરમાં સુપર સ્કાઇબ કરીને "વસ્તુઓની ખરીદી માટેના ટેન્ડરો" તેની સાથે રૂ.૫,૦૦૦/–ની અર્નેસ્ટ મની ડિપોઝિટ (ઈએમડી) અનામત કિંમતના ૧૦% જે ડીડી/આરટીજીએસ/એનઈએફટી દ્વારા અધિકૃત અધિકારી, કેનરા બેંક, ખાતા નં:- 209272434; IFSC:- CNRB0003966, ને તા. ૨૪.૦૪.૨૦૨૪ કે તે પહેલા જમા કરાવવાના રહેશે. એફ) બે અથવા વધુ બિડર્સના કિસ્સામાં, તે પછી કથિત વેચાણ સેવા પ્રદાતા મેસર્સ સી૧ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અથવા ઓક્શન ટાઇગર દ્વારા ઑનલાઇન મોડ દ્વારા હાથ ધરવામાં આવશે. જી) વેચાણ સફળ ટેન્ડરરની તરફેણમાં પુષ્ટિ કરવામાં આવશે, સુરક્ષિત લેણદાર દ્વારા તેની પુષ્ટિને આધીન. **એચ.**) સફળ ટેન્ડરરે તેની તરફેણમાં ટેન્ડરની ફાળવણી પર તરત જ સંપૂર્ણ વેચાણ કિંમત (પહેલેથી ચૂકવેલ ઈએમડી સહિત) જમા કરાવવાની રહેશે. જો સફળ ટેન્ડરર ઉપર જણાવ્યા મુજબ વેચાણ કિંમત ચૂકવવામાં નિષ્ફળ જાય, તો તેણે કરેલી ડિપોઝીટ જપ્ત કરવામાં આવશે. **આઇ**) કન્વેયન્સ, સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ચાર્જ વગેરે માટેના તમામ ચાર્જીસ, જેમ લાગુ પડે છે, તે માત્ર સફળ ટેન્ડરન દ્વારા જ વહન કરવામાં આવશે. 🕏) અધિકૃત અધિકારી કોઈપણ કારણ આપ્યા વિના ટેન્ડરના નિયમો અને શરતોને મુલતવી/૨૬ કરવાનો અથવા તેમાં ફેરફાર કરવાનો અધિકાર અનામત રાખે છે. કે) વધ વિગતો માટે ફોન નં. ૦૭૯-૬૯૦૨૭૮૧૨ / ૮૧૮ / ૮૨૦ / ૮૨૨, મોબ- ૮૨૩૮૦૯૧૯૪૨, ઈ-મેલ આઈડી: cb3966@canarabank.com પર નીચે સહી કરનારનો સંપર્ક કરો.

તારીખ : ૨૧-૦૩-૨૦૨૪. સહી/- અધિકૃત અધિકારી, સ્થળ : ગાંધીનગર કેનરા બેંક

કબજા નોટીસ

ાણીતી) ના અધિકૃત અધિકારીએ, સિક્ચોરીટાઇઝેશન અને રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિય ખેસેટ્સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ <u>હે</u>ઠળ અને સિક્ચોરીટી ઇન્ટરેસ એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૩ સાથે વંચાતી કલમ ૧૩(૧૨) હેઠળ મળતી સત્તાનો ઉપયો કરીને દેવાદાર(રો)/ સહ-દેવાદાર(રો) ને **માંગણાં નોટીસ** જારી કરી દેવાદારોને તેમના લાગતા વળગત નામ સામે જણાવેલ ૨કમ જણાવેલ નોટીસમાં જણાવ્યા મુજબ લાગુ દરોએ તેના પરના વ્યાજ તેમજ ચુકવણી અને /અથવા છુટકારાની તારીખ સુધી લદાચેલ ચડત વ્યાજ, લાગું આકસ્મિક ખર્ચ, પડતર ખર્ચ, ચાર્જ વગેરે સહીત જણાવેલ નોટીસો મળ્યાથી ૬૦ દિવસની અંદર ચુકવવા જણાવ્યું હતું.

| 중મ ન. | લોન નંબર | દેવાદાર/ સહ–દેવાદાર/ જામીનદાર/ગીરવેદાર | ૧૩(૨) નોટીસની તારીખ / બાકી રકમ (રૂા. માં) ના રોજ | કબજાનો પ્રકાર અને તારીખ / સમય |
|----------|----------------|--|---|---------------------------------------|
| ۹. | x4546x5000x3e5 | ૧) વરૂણ રામ સોમન રામ ૨) ઉષા બરુણ રામ | ૨૧-૧૦-૨૦૨૩ રૂા.૧૦,૯૬,૦૫૦/- (રૂપિયા દસ લાખ છશું હજાર પચ્ચાસ પુરા) ૨૦ -૧૦-૨૦૨૩ મુજબ | ૧૭-૦૩-૨૦૨૪ ૦૭:૨૦ એએમ ભૌતિક કબજો |
| | | | | |

સિક્ચોર્ડ મિલકતની વિગત : પ્લોટ નં. ૭૧, ક્ષેત્રફળ ૫૩.૩૩ ચો.ચાર્ડ એટલે કે ૪૪.૫૯ ચો.મી. (કે.જે.પી પછી બ્લોક નં. ૧/૭૧ ક્ષેત્રફળ ૪૮.૦૧ ચો.મી. તેમજ ૨૧.૦૯ ચો.મી. રોડ અને સીઓપીની જમીનમાં ન વહેચાચેલ હિસ્સો, 'સાંઇ પવિત્ર રેસીડેન્સી' માં, જુના બ્લોક નં.૭, નવે બ્લોક નં. ૯, ક્ષેત્રફળ હે.અરે ૧–૧૫–૮૭ રો.મી. જમીન સ્થાવર મિલકર્તના તમામ ભાગ અને હિસ્સા. **ચતુઃસીમાઃ** પુર્વઃ પ્લોટ નં. ૮૪, પશ્ચિમઃ સોસચટીનો અંદરનો રોડ, ઉત્તરઃ પ્લોટ નં. ૭૦ દક્ષિણ: પ્લોટ નં. ૭૨

| | | ૧) જીતેન્દ્રભાઇ પટેલ | 4x-oc-5053 | | ĺ |
|---|----------------|----------------------|------------------------------|--------------------|---|
| | | ૨) દિપાલીબેન | ३।. १०,१७,६१५.८०/− (३ | 4%-03-505 8 | ı |
| 5 | 39606630000008 | જીતેન્દ્રબાઇ પટેલ | પિયા દસ લાખ સત્તર હજાર | ૧૨:૪૦ પીએમ | ı |
| | | ૩) પટેલ ચિમનભાઇ | છસ્સો પંદર અને એંશી પૈસા | ભૌતિક કબજો | ĺ |
| | | મગનભાઇ | પુરા) ૧૩-૦૮-૨૦૨૩ મુજબ | | ĺ |

સિક્ચોર્ડ મિલકતની વિગત : જિલો આણંદ,પેટા જિલો આણંદ, મોજે ગામ વાસદ, ગ્રામ પંચાયત મિલકત નં. ૫૨૨. **ચતુઃસીમાઃ** પુર્વઃ પટેલ મહેશભાઇ ૨૫છોડભાઇનું ઘ૨, પશ્ચિમઃ પટેલ અશોકભાઇ ધુલાભાઇનું ઘર, ઉત્તર: જાહેર રોડ, દક્ષિણ: રબારી વાસ

| 3 | ૧) રણિંગા લક્ષ્મણભાઇ કન્દુભાઇ, ૨) રણિંગા રાજુબેન હિંદુભાઇ | 31 X 110 C35/- /3111511 | ૧૮–૦૩–૨૦૨૪ ૧૧:૧૦ એએમ સાંકેતિક કબજો |
|---|--|-------------------------|---|

સિક્ચોર્ડ મિલકતની વિગત : ગ્રાઉન્ડ ફ્લો૨, ચુનિટ નં. ૭, ક્ષેત્રફળ ૫.૫૭ ચો.મી. (ગ્રાઉન્ટડ ફ્લોરના હક સાથે),પ્લોટ નં. ૨૫કી, "આશાપુરી કો.ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લીમીટેડ સુરેન્દ્રનગર સિટી સર્વે નં. ૪૯૬૬/બી–૨૧ પૈકી સિટી સર્વે વોર્ડ નં.૧, દાલ મીલ એરિયા, મુકામ-સુરેદ્રનગર મ્યુનિસિપલ લીમીટ, સુરેન્દ્રગર દુધરેજ વઢવાણ મ્યુનિસિપાલિટી. **ચતુઃસીમા** ઉત્તર : ૧.૮૫ મીટરનો બ્લોક નં. ૨૦, દક્ષિણ : ૧.૮૫ મીટર યુનિટ નં. ૮, પૂર્વ : ૦૩.૦૧ મીટર બાજુનો યુનિટ નં. ૧, પશ્ચિમ : ૦૩.૦૧ મીટર બાજુનો ૭.૬૨ મીટર પહોળો રોડ અને શટર

| 8 | 34866850000663 | ૧) સુરેલા અનિલકુમાર માનજીભાઇ, ૨) સુરેલા હેતલબેન અનિલકુમાર | २ ६ ॥२ ॥२४/ =/२ ॥२ १९ | ૧૮–૦૩–૨૦૨૪ ૧૧:૧૦ એએમ સાંકેતિક કબજો |
|---|----------------|--|--------------------------------|---|
| | 0) (0 | | , x · o · | -\ |

સેક્ચોર્ડ મિલકતની વિગત : પ્લોટ નં. રતનપર રેવન્યુ સર્વે નં. ૭૬, જમીનનું ક્ષેત્રફળ પદ્ .૦૦ ચો.મી., તેમજ મુકામ-રતનપર, મ્યુનિસિપલ લીમીટ, તાલુકો-વઢવાણ, જિંદ્યો-સુરેન્દ્રનંગર ખાતેની રેસિડેન્સીચલ મિલકત. **ચતુઃસીમા**્ ઉત્તર : ૧૪.૦૦ મીટર, પ્લોટ નં. ૪૨ પૈકી, દક્ષિણ : ૧૪.૦૦ મીટર, પ્લોટ નં. ૩૯, પુર્વ : ૪.૦૦ મીટર, ૭.૫૦ મીટરનો પહોળો રોડ, પશ્ચિમ : ૪.૦૦ અહીં ઉપર જણાવેલ દેવાદારો / સહ–દેવાદારો / જામીનદારો / ગીરવેદારો બાકી રકમ ચકવવામ

નિષ્કળ ગયા હોવાથી ખાસ કરીને ઉપર જણાવેલ દેવાદારો અને જાહેર જનતાને નોટીસ આપવા આવે છે કે જના સ્મોલ ફાયનાન્સ બેંક લીમીટેડના અધિકૃત અધિકારીએ જણાવેલ નિયમોના નિયમ સાથે વંચાતી એક્ટની કલમ ૧૩(૪) હેઠળ તેમને પ્રાપ્ત સત્તાનો ઉપયોગ કરીને ઉપર જ્યાવેલ તારીખોએ અહી ઉપર જણાવેલ મિલકતો / સિક્યોર્ડ એસેટોનો **કળજો** લઇ લીધો છે. ખાસ કરી અહી ઉપર જણાવેલ દેવાદારો / જામીનદારો / ગીરવેદારો અને જાહેર જનતાને આથી ઉપર જણાવેલ મિલકતો / સિક્ચોર્ડ એસેટો સાથે સોદો ન કરવા સાવધ કરવામાં આવે છે અને જણાવેલ મિલકતો સિક્યોર્ડ એસેટો સાથે કોઇપણ સોદો જના રમોલ કાયનાન્સ બેંક લીમીટેડના ચાર્જને આધિન રહેશે

સ્થળ : અમદાવાદ સહી/– અધિકૃત અધિકારી જના સ્મોલ ફાયનાન્સ બેંક લીમીટેડ વતી તારીખ : ૨૧–૦૩–૨૦૨૪ જના સ્મોલ ફાયનાન્સ બેંક

રજીસ્ટર્ડ ઓફીસ: ધ ફેરવે, ગ્રાઉન્ડ અને પહેલો માળ, સર્વે નં. ૧૦/૧, ૧૧/૨ અને ૧૨/૨બી, ઓફ ડોમલુર, કોરમંગલા ઇનર રીંગ રોડ, ઇજીએલ બિઝનેશ પાર્ક પછી, ચક્ષાઘટ્ટા, બેંગ્લોર–૫૬૦૦૭૧ <u>રીજનલ બ્રાન્ચ ઓફીસ</u> : જના રમોલ ફાયનાન્સ બેંક લીમીટેડ, ૨૦૮ થી ૨૧૩, બીજો માળ, સાંગરીલ

આર્કેડ, સારસ્વત બેંક ઉપર, ૧૦૦ ફૂટ આનંદ નગર રોડ, શ્ચામલ, અમદાવાદ, ગુજરાત–૩૮૦૦૧૫

केन्स बैंक Canara Bank 📣 निविकेट Syndicate

પી. બી. નં. ૧૭, ૩૯૫ - ૩૯૬, સેજપુર બોઘા, ਗ**ਦ**ੀਵਾ ਦੀਵ - ਤਟੁਤੂਤਪ

કબજા નોટિસ (સ્થાવર મિલકત માટે) આથી નીચે સહી કરનાર કેનેરા બેંક નરોડા શાખા, અમદાવાદના અધિકૃત

अधिङारी द्वारा सिड्योरिटाछ्रोशन એन्ड रीङन्स्ट्रङ्शन ओङ् झएनान्सियल એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ (૨૦૦૨નો એક્ટ ૫૪) (હવેથી કહેવાશે કાયદો)ના સેક્શન ૧૩(૧૨) અને તેની સાથે સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રુલ્સ ૨૦૦૨ના રુલ 3ને વાંચતાં આ **કિમાન્ડ નોટિસ તા. ૧૫.૦૧.૨૦૨૪** ના જારી કરવામાં આવી છે જેના દેવાદાર **મે. એસવીપી** ઈન્ડસ્ટ્રીઝ (ભાગીદાર પેઢીઃ શ્રીમતી લક્ષ્મીબેન વિનોદભાઈ શાહ, શ્રીમતી અનુ પ્ર**દિપકુમાર વર્મા** ને નોટિસમાં જણાવેલી ૨કમ જે **રૂ. ૧,૩૦,૬૦,૦૫૮.૩૨/- (રૂપિચા** એક કરોડ ત્રીસ લાખ સાઈઠ હજાર અહ્ટાવન અને બત્રીસ પૈસા પૂરા) અને રૂા. ૫૦,૪૯,७૦૩.૯૩/- (રૂપિયા પચાસ લાખ ઓગણપચાસ હજાર સાતસો ત્રણ અને ત્રાણું **પેસા પુરા) જે ૧૫.૦૧.૨૦૨૪**થી આગામી વ્યાજ, લાગુ ચાર્જાસ આ નોટીસ મળ્યાની તારીખથી ૬૦ દિવસમાં ચૂક્વવાનું જણાવવામાં આવ્યું હતું. દેવાદાર અને જામીનદાર રકમની ચૂકવણી કરવામાં નિષ્ફળ ગયા હોવાથી દેવાદાર અને

જામીનદાર અને જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે નીચે સહી કરનારે આ કાયદાની ક્લમ ૧૩(૪) हेठળ नियम ८ અने ૯ साथै वंचाएं। वर्धने नीचे वर्धवित मिलङ्तनो **प्रत्यक्ष** ક્લજો ૨૦.૦૩.૨૦૨૪ના રોજ લીધો છે. ખાસ કરીને દેવાદાર /જામીનદાર / ગીરવેદાર તથા જાહેર જનતાને જણાવવામાં

आवे छे हे भिवहत अंगे होए प्रहारनो व्यवहार हरवो नहीं अने शे होए વ્યવહાર કરવામાં આવશે તો તે રકમ **કેનેરા બેંક**ના લેણાં નીકળતા **રૂ.** ૧,૩૦,૬૦,૦૫૮.૩૨/- (રૂપિયા એક કરોડ ત્રીસ લાખ સાઈઠ હજાર અહાવન અને બગ્રીસ પૈસા પૂરા) અને રૂા. ૫૦,૪૯,७૦૩.૯૩/- (રૂપિયા પચાસ લાખ ઓગણપચાસ હજાર સાતસો ત્રણ અને ત્રાણું પૈસા પુરા) જે ૧૫.૦૧.૨૦૨૪થી આગામી વ્યાજ અને લાગુ ચાર્જ સહિતના રહેશે.

સલામત મિલકતો છોડાવવા માટે ઉપલબ્ધ સમય અંગે આ કાયદાની પેટા ક્લમ ૧૩(૮)ની જોગવાઈ અંગે દેવાદારોનું ધ્યાન દોરવામાં આવે છે.

સ્થાવર મિલકતનું વર્ણન

સ્થાવર મિલકતના તમામ પીસ અને પાર્સલ જમીનદારક ઔદ્યોગિક પ્લોટ/બિલ્ડીંગ નં. ૧૨ પ્લોટ એરીયા આશરે ૬૮૯.૮૩ ચો.મી. અને બિલ્ટઅપ એરીયા આશરે ૪૬૫.૬૮ ચો.મી. અને અવિભાજય પ્રમાણસર હિસ્સો એરીયા આશરે ૨૩૨.૮૪ યો.મી. સ્કીમ જાણીતી સમૃદ્ધિ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક, બાંધકામ એન.એ. જમીન પર ધારક (૧) બ્લોક/સર્વે નં. ૮૧૩ એરીયા આશરે ૧૧૫૬૦ ચો.મી. (૨) બ્લોક/સર્વે નં. ૨૬૭ એરીયા આશરે ૨૨૮૫૩ ચો.મી. (૩) બ્લોક/સર્વે નં. ૨૭૩ એરીયા આશરે ૧૩૪૪૭ ચો.મી એટલે કુલ એરીયા આશરે ૪૫૮૫૫ યો.મી .પૈકી એરીયા આશરે ૧૧૪૪૨ ચો.મી. ઔદ્યોગિક હેતુ માટે મોજે : ચાંદીઅલ, તા. દસ્ક્રોઈ, ૨જી. ડિસ્ટ્રીક્ટ અમદાવાદ અને २૪. સબ ડિસ્ટ્રીક્ટ અમદાવાદ-૧૨ (નિકોલ) **ચત્સીમા**: પૂર્વ: ૭૦ ફૂટ રોડ, પશ્ચિમઃ સ્કીમ હદ, ઉત્તર: કોમન પ્લોટ, દક્ષિણઃ પ્લોટ गं. ०३.

તારીખ : ૨૦.૦૩.૨૦૨૪ સ્થળ : અમદાવાદ

અધિકૃત અધિકારી